

ત્વરિત જાહેરાત માટે

આપણે સૌએ તૈયાર રહેવાની ભૂમિકા ભજવવાની છે
સીટી ઓફ બ્રમ્પટનને ઈમરજન્સી પ્રિપેરેડનેસ વીક મે 3-9, 2020 માન્ય રાખ્યું

બ્રમ્પટન, ઓન્ટેરિયો (મે 4, 2020) – સીટીએ મે 3 થી 9 સુધીના, ઈમરજન્સી પ્રિપેરેડનેસ વીક (EPW) ને માન્ય રાખ્યું છે. આ વર્ષે, COVID-19 મહામારીને ધ્યાનમાં લેતા, સીટી આપણાં રહેવાસીઓને યાદ અપાવે છે કે હવે પહેલાં કરતા વધારે મહત્વની બાબત એ છે કે, આપણે સૌ સુરક્ષિત અને તૈયાર રહેવાની ભૂમિકા ભજવીએ.

રહેવાસીઓ માહિતગાર રહીને, વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવીને અને પીલ પબ્લિક હેલ્થની સલાહ અનુસરીને, COVID-19 નાં ફેલાવા સામે પોતાને અને સમુદાયને સુરક્ષિત રાખવામાં મદદ કરી રહ્યાં છે. સીટી બ્રમ્પટનને સુરક્ષિત રાખવાના આ પ્રયત્નો ચાલુ રાખવા રહેવાસીઓને પ્રોત્સાહિત કરે છે.

સીટી પોતાની ઈમરજન્સી મેનેજમેન્ટ ટીમ અને સામુદાયિક ભાગીદારોનો પણ આભાર માને છે જેઓ આ સમયે પોતાના આયોજનને અમલમાં મૂકી રહ્યાં છે અને COVID-19 કટોકટી દરમિયાન આપણાં સમુદાયની સુરક્ષાને સુરક્ષિત કરવા સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખી રહ્યાં છે.

દર વર્ષે, EPW એ સમય છે જે રહેવાસીઓને [બ્રમ્પટનની ઈમરજન્સી પ્રિપેરેડનેસ ગાઈડ](#) અને આકરું હવામાન, પૂર અને વીજળી પુરવઠો ખોરવાવો સહિતની, તમામ પ્રકારની સંભવિત કટોકટીઓ માટે તૈયાર રહેવાની સમીક્ષા કરવાનું યાદ અપાવે છે. વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, www.brampton.ca/prepared.

અવતરણો (ક્વોટ્સ):

“અમારા ભાગીદારો સાથે, સીટીમાં સમગ્ર ટીમ અથાકપણે કાર્યરત છે, જેથી અમે COVID-19 સામે પ્રતિક્રિયા કરીએ ત્યારે આપણાં સમુદાયને આરોગ્ય અને સુરક્ષાની ખાતરી કરાવી શકાય. દરેક વ્યક્તિને માહિતગાર રાખવાનું અને પ્રતિભાવોનું સંકલન કરવાનું કાર્ય કોઈ નાનું પરાક્રમ નથી. COVID-19 નાં ફેલાવાનો સામનો કરવા આપણે સૌ સાથે મળીને કાર્યરત હોવાની ખાતરી કરાવવામાં અમારી બ્રમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસ અને રીજીયન ઓફ પીલમાં ઈમરજન્સી મેનેજમેન્ટ કર્મચારીઓએ કરેલા પ્રયત્નોની હું પ્રસંશા કરવા ઈચ્છું છું.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રમ્પટન

“આપણે સૌએ COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં ભૂમિકા ભજવવાની રહે છે. વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવીને અને વાઈરસનો ફેલાવો રોકવામાં મદદરૂપ થઈને આપણાં સમુદાયને સુરક્ષિત રાખવામાં પોતાની નિર્ણાયક ભૂમિકા ભજવવા બદલ, આપણાં રહેવાસીઓનો આભાર.”

- રોવિના સેન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર વોર્ડ્સ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસીસ કમિટી, સીટી ઓફ બ્રમ્પટન

“COVID-19 સામે આપણાં સીટીનો એકીકૃત પ્રતિભાવ એ અમારા કર્મચારીઓની સાથે સાથે અમારા ભાગીદારોની તૈયારી અને આચરણનું પરિણામ છે. કટોકટીમાં ક્વાયતોથી માંડીને અવિરત તૈયારી અને શિક્ષણ પ્રવૃત્તિઓ સુધી, અમારી બ્રમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસ ખાતરી કરાવે છે કે આપણાં સમુદાયમાં કોઈપણ કટોકટી સામે પ્રતિક્રિયા કરવામાં બધાં પગલાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે.”

- જેફ બોમેન (Jeff Bowman), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; સભ્ય, બ્રમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ કમિટી, સીટી ઓફ બ્રમ્પટન

“આ ઈમરજન્સી પ્રિપેડનેસ વીક બીજા એક વીક જેવું જ છે જેમાં અમારી ટીમ COVID-19 મહામારીની વાસ્તવિકતાઓને પ્રતિભાવ આપે છે. અમારી ઈમરજન્સી મેનેજમેન્ટ ટીમના અથાકભર્યા આયોજન અને સંકલનભર્યા પ્રયત્નોને આભારી થવાની સાથે સાથે, આ વાઈરસનો સામનો કરવા અમારી સાથે કાર્યરત આપણાં રહેવાસીઓ અને ધંધાઓની કટિબદ્ધતા વડે, અમે ભવિષ્ય માટે અને છેવટે સીટીને ફરી ખોલવાનું આયોજન કરવા આશાવાદી છીએ. અમે કહીએ છીએ કે દરેક વ્યક્તિ તૈયાર રહે અને આરોગ્ય સંભાળ અને કટોકટી વ્યવસાયિકોની સલાહ અનુસરવાનું ચાલુ રાખે જેથી આપણાં સમુદાયની સુરક્ષા અને સ્થિતિસ્થાપકતાની ખાતરી કરાવી શકાય.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા દુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca